



GMM/SEC/2024-25/87

February 7, 2025

To,  
BSE Limited  
Scrip Code: 505255

National Stock Exchange of India Limited  
Symbol: GMPFAUDLR

**Sub.: Copy of Published Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and nine months ended December 31, 2024**

**Ref.: Regulation 30 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Dear Sir/ Ma'am,

Please find enclosed a copy of the Unaudited Standalone and Consolidated Financial Results of GMM Pfaudler Limited for the quarter and nine months ended December 31, 2024 published in Economic Times, Mumbai & Ahmedabad Edition and in Naya Padkar, Anand on February 7, 2025 for your records.

Kindly take the same on record.

Thanking you.

Yours faithfully,

For **GMM Pfaudler Limited**

**Mittal Mehta**  
**Company Secretary & Compliance Officer**  
**FCS. No. 7848**

**Encl.:** As above

**GMM Pfaudler Ltd.**

Corporate Office: 902 VIOS Tower, New Cuffe Parade, Sewri-Chembur Rd, Mumbai 400037  
Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388325  
O: +91 22 6650 3900 | F: +91 2692 661888 | CIN: L29199GJ1962PLC001171  
W: www.gmmpfaudler.com | E: sales@gmmpfaudler.com

**PFAUDLER**  
Glass-Lined Technology

**NORMAG**  
Lab & Process Glass

**MAVAG**  
Filtration & Drying

**MIXION**  
Mixing Technology

**INTERSEAL**  
Sealing Technology

**EQUILLOY**  
Alloy Process Equipment

**EDLON**  
Fluoropolymers

**HYDROAIR**  
Membrane Separation Systems

FOR SMOOTH GRID INTEGRATION OF RENEWABLE ENERGY FROM VARIOUS ZONES

# Phase Three of Intra-state Green Energy Corridor in Works: Joshi

Shilpa Samant

New Delhi: The government is planning to initiate the third phase of the intra-state Green Energy Corridor for seamless evacuation of green energy, said Pralhad Joshi, minister for new and renewable energy. In an interview, Joshi said the power ministry has set the March 31 deadline for states to submit proposals for the intra-state transmission project. Once the states hand over the proposals, further action will be taken for approval. Edited excerpts:



PM SURYA GHARA

In FY26, scheme aims to install rooftop solar systems in 3.5 million households adding 10.5 GW of renewable energy capacity

PRALHAD JOSHI  
New and renewable energy minister

## What's the motive behind huge increase in your ministry's allocation for clean energy?

Increase in budgetary allocation for renewable energy to ₹26,549 crore, up 53.5% from the last one, reflects the government's commitment towards sustainable development by increasing participation of the common man in energy transition with initiatives such as PM Surya Ghar: Muft Bijli Yojana and PM-KUSUM. By sustaining existing support and incentives while introducing forward-looking interventions, Budget 2025 will fast track India's progress toward its ambitious target of 500 GW renewable energy capacity by 2030 and its ultimate goal of achieving net zero by 2070.

## How many households is your ministry targeting in FY26 under PM Surya Ghar?

In FY26, the scheme aims to install rooftop solar systems in 3.5 million households, adding 10,500 MW of renewable energy capacity. This will significantly enhance India's clean energy footprint.

## Have you drawn up a plan for the National Manufacturing Mission for clean technology?

A significant focus of the mission is on clean tech manufacturing, reinforcing India's commitment to climate-friendly industrial growth. The initiative will supplement the efforts already announced by the government to strengthen the domestic supply chains. Currently, local module manufacturing capacity is over 67 GW per year

and cell manufacturing capacity of about 15 GW is available in the country. Further, advanced technology has achieved 70-80% indigenisation with strong domestic manufacturing in the wind sector having a capacity of about 18 GW. However, domestic manufacturing of few wind turbine components are to be developed, which would be undertaken in the proposed mission. Green Hydrogen being an evolving sector will also benefit from the proposed mission.

## The budget mentions intra-state capacity augmentation. Have any plans been formulated?

There are certain challenges in transmission but we are all geared up. Matching renewable energy capacity and transmission and evacuation is an ongoing and dynamic issue. To address the transmission issue in the renewable energy sector, the budget has proposed intra-state transmission capacity augmentation as a key priority. The government plans to incentivise states for transmission reforms. Under GEC Phase-I, implemented across eight states, over 9,135 circuit km transmission lines and 21,333 MVA substations have been completed. Rajasthan, Tamil Nadu, Karnataka, and Madhya Pradesh have completed their projects, while the rest are expected to do so by mid-2025. GEC Phase-II is under implementation in seven states, with 7,919 circuit km and 24,488 MVA substations planned for completion by FY26. The government is also considering the launch

of intra-state Green Energy Corridor Phase-II to enable seamless evacuation and grid integration of renewable energy from new and emerging Renewable Energy Zones. The Ministry of Power has set a deadline of March 31 for all states to submit their proposals, ensuring timely planning and execution. Once the proposals are received from states, further action will be taken for the approval of GEC III.

## When can we see awarding of offshore wind projects under the VGF scheme?

Under the VGF scheme, SECI issued the first tender for a 500 MW offshore wind energy project off the Gujarat coast in September. The pre-bid meeting for the project was held in December. The bid submission deadline is March 19, and the project is expected to be awarded in FY26. Additionally, the offshore wind study and survey for the 500 MW capacity off the Tamil Nadu coast under the scheme is expected to be completed by October 2025. The tender for this site will be issued subsequently.

## The green energy industry has been seeking extension of ISTS waiver. Has any decision been taken?

Renewable energy developers are requesting an extension of the waiver of ISTS (Inter-State Transmission System) charges beyond June 2025. We are examining the request in consultation with the Ministry of Power and other stakeholders.



## Swiggy Limited

(formerly known as Swiggy Private Limited, Bundl Technologies Private Limited)  
CIN: L7410KA2013PLC096530

Registered office: No. 55, Sy No. 8-14, Ground Floor, 16J Block, Embassy Tech Village, Outer Ring Road, Devarisanoahalli, Bengaluru - 560103, Karnataka, India.  
Tel: 080-68422422 | Email ID: [in@swiggy.in](mailto:in@swiggy.in) | Web site: [www.swiggy.com](http://www.swiggy.com)

### Statement of unaudited financial results (standalone and consolidated) for the quarter and nine months ended December 31, 2024

The board of directors of the Company, at the meeting held on February 05, 2025, approved the unaudited financial results of the Company for the quarter and nine months ended December 31, 2024 ("Financial Results").

The Financial results along with the Limited Review Report, have been posted on the Company's website at

<https://www.swiggy.com/corporate/investor-relations/financial-results> and can be accessed by scanning the QR code.



For and on behalf of the Board of Directors  
Swiggy Limited  
(formerly known as Swiggy Private Limited, Bundl Technologies Private Limited)

Sd/-  
Sriharsha Majety  
Managing Director &  
Group Chief Executive Officer  
DIN: 06680073

Location: Bengaluru  
Date: February 05, 2025

Note: The above intimation is in accordance with Regulation 33 read with regulation 47 (f) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

# Uno Minda Limited

(Formerly known as Minda Industries Ltd.)

(CIN: L74899DL1992PLC050333)

REGD. OFFICE: B-64/1, Wazirpur Industrial Area, Delhi-110052

CORP. OFFICE: Village Nawada Fatehpur, P. O. Sikandarpur Badda,

Near IMT Manesar, Gurgaon (Haryana) - 122004

Tel.: +91 124 2290427/28, 2290693/94/96

E-mail: [investor@unominda.com](mailto:investor@unominda.com), Website: [www.unominda.com](http://www.unominda.com)



## EXTRACTS OF THE STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER, 2024

Consolidated						Standalone							
Quarter Ended		Nine Months Ended		Year Ended	PARTICULARS	Quarter Ended		Nine Months Ended		Year Ended			
31-12-2024	30-09-2024	31-12-2023	31-12-2023	31-12-2024		31-12-2024	30-09-2024	31-12-2023	31-12-2023	31-03-2024			
Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Audited		Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Audited			
4,183.99	4,244.79	3,522.91	12,246.29	10,236.87	1,400.89	1	Total Income from Operations	3,136.22	3,121.35	2,610.85	9,062.43	7,618.87	10,498.11
300.99	336.07	270.02	914.53	805.10	1,165.21	2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extra-Ordinary Items)	173.34	369.86	172.70	725.70	592.23	809.50
300.99	344.61	270.02	923.07	805.10	1,191.83	3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extra-Ordinary Items)	173.34	369.86	172.70	725.70	592.23	839.11
254.37	266.16	205.11	731.33	622.99	924.71	4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extra-Ordinary Items)	157.26	319.60	131.05	617.13	475.43	665.41
233.56	256.69	191.89	690.09	561.83	886.78	5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and other Comprehensive (non-transferable) items	144.63	299.97	120.19	575.83	420.29	617.54
114.83	114.83	114.83	114.83	114.83	114.82	6	Paid-up Equity Share Capital (Face Value Rs. 2 per share)	114.83	114.83	114.83	114.83	114.83	114.82
-	-	-	-	-	4,842.51	7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of Previous Year)	-	-	-	-	-	4,085.11
4.05	4.27	3.38	11.79	10.33	15.36	8	Earnings Per Share (face value of Rs. 2 each) (for continuing and discontinued operations) (not annualised)	2.74	5.56	2.29	10.74	8.30	11.60
4.04	4.26	3.37	11.76	10.32	15.24	9	(ii) Diluted EPS (in Rs.)	2.73	5.55	2.28	10.72	8.29	11.59

### Additional Information on Standalone Financial Results :

S. No.	PARTICULARS	Quarter Ended	Year Ended
		31-12-2024	31-03-2024
		Un-Audited	Audited
1.	Securities Premium Account	1,482.98	1,459.33
2.	Net worth	4,708.48	3,982.71
3.	Outstanding Debt	1,721.53	964.78
4.	Debt Equity Ratio	0.38	0.26
5.	Capital Redemption Reserve	18.39	18.39
6.	Debt Service Coverage Ratio	3.6	4.37
7.	Interest Service Coverage Ratio	7.81	12.65

- Notes:-**
- The Consolidated and Standalone Financial Results for the quarter and nine months ended on 31 December 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 6 February 2025.
  - The Board has approved and declared an interim dividend of Rs. 0.75 per share i.e. 37.50% on equity shares (face value of Rs. 2 each). In term of regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Board has fixed Wednesday, 12 February, 2025 as the "Record Date" for the purpose of ascertaining the eligibility of shareholders, for the payment of interim dividend.
  - The above is an extract of the detailed format of the financial results of the company for the quarter and nine months ended on 31 December 2024 filed with stock exchanges pursuant to Regulation 33 & 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of both these results (standalone and consolidated) are available on the stock exchange website(s) NSE website ([www.nseindia.com](http://www.nseindia.com)), BSE website ([www.bseindia.com](http://www.bseindia.com)) and on Company's website ([www.unominda.com](http://www.unominda.com)).
  - For exceptional and the other line items referred in regulation 52(4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, pertinent disclosures have been made to the Stock Exchange(s) (NSE & BSE) and can be accessed on the NSE website ([www.nseindia.com](http://www.nseindia.com)), BSE website ([www.bseindia.com](http://www.bseindia.com)) and on Company's website ([www.unominda.com](http://www.unominda.com)).



For and on behalf of the Board of  
Uno Minda Limited  
  
NIRMAL K. MINDA  
Chairman & Managing Director  
DIN: 00014942

Place : Gurgaon (Haryana)  
Date : 06 February, 2025

Follow us on:

Uno Minda Limited is a flagship company of UNO MINDA Group. The Group is a Tier 1 Auto Component Supplier to all leading OEMs in India and across the Globe. It manufactures Alternators, Switches, Lamps, Batteries, Horns, GNL/LED Kits, Fuel Cops, Electronic Components, Alloy Wheels, Oil Gating and Blow Moulding Components.

# GMM PFAUDLER LIMITED

Registered Office & Works: Vithal Udyognagar, Karamsad 388 325, Gujarat, India  
CIN No: L29199GJ1962PLC001171, Email ID: [investorservices@gmmpfaudler.com](mailto:investorservices@gmmpfaudler.com)  
Website: [www.gmmpfaudler.com](http://www.gmmpfaudler.com)

## Extract of Statement of Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2024

₹ in Crore (except per share data)

Sr. No.	Particulars	Consolidated					
		Quarter Ended		Nine Months Ended		Year Ended	
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
		[Refer Note (ii)]	[Refer Note (ii)]	[Refer Note (ii)]	[Refer Note (ii)]	[Refer Note (ii)]	[Refer Note (ii)]
1	Total Income from Operations	801.48	805.42	856.00	2,392.10	2,705.75	3,446.48
2	Net Profit / (Loss) (before tax, Exceptional Items)	61.67	30.31	-46.72	130.41	219.81	250.81
3	Net Profit / (Loss) before tax (after Exceptional Items)	61.67	30.31	-46.72	130.41	219.81	250.81
4	Net Profit / (Loss) after tax (after Exceptional Items)	40.03	15.24	-27.93	77.11	145.39	170.66
5	Total Comprehensive (Loss) / Income for the period / Year	(4.91)	46.33	28.86	55.91	148.03	165.44
6	Paid-up Equity Share Capital (Face Value of ₹ 2/- each)	8.99	8.99	8.99	8.99	8.99	8.99
7	Other Equity						955.37
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of ₹ 2/- each) (not annualised for quarter and nine months ended)						
	(i) Basic	9.23	3.39	6.42	17.78	32.88	39.03
	(ii) Diluted	9.23	3.39	6.42	17.78	32.87	39.02

### Key numbers of Standalone Unaudited Financial Results

Sr. No.	Particulars	Standalone					
		Quarter Ended		Nine Months Ended		Year Ended	
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Turnover	237.80	208.02	259.62	668.91	806.08	1,030.61
2	Profit before tax	15.01	10.55	14.25	35.69	57.64	69.71
3	Profit after tax	11.74	7.82	10.80	27.10	43.44	51.05

- Notes:**
- The above is an extract of the detailed format of the quarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and nine months ended December 31, 2024 financial results are available on the Stock Exchange websites viz. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) and on the company's website viz. [www.gmmpfaudler.com](http://www.gmmpfaudler.com). The same can be accessed by scanning the QR Code provided below.
  - Consolidated Results for the quarter ended September 30, 2024 & December 31, 2023, nine months ended December 31, 2023 and ended March 31, 2024 has been restated on account of completion of final determination of fair values of identified assets and liabilities for the purpose of Purchase Price Allocation of the acquired entities during the Financial year 2022-23 & 2023-24.

Place: Mumbai  
Date: February 6, 2025



GMM Pfaudler

For GMM Pfaudler Limited  
Sd/-  
Tarak Patel  
Managing Director  
DIN: 00166183

# GMM PFAUDLER LIMITED

Registered Office & Works: Vithal Udyognagar, Karamsad 388 325, Gujarat, India  
 CIN No: L29199GJ1962PLC001171, Email ID: investorservices@gmmpfaudler.com  
 Website: www.gmmpfaudler.com

## Extract of Statement of Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2024

₹ in Crore (except per share data)

Sr. No.	Particulars	Consolidated					
		Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
		[Refer Note (ii)]	[Refer Note (ii)]		[Refer Note (ii)]	[Refer Note (ii)]	
1	Total Income from Operations	801.48	805.42	856.00	2,392.10	2,705.75	3,446.48
2	Net Profit / (Loss) (before tax, Exceptional items)	61.67	30.31	46.72	130.41	219.81	250.81
3	Net Profit / (Loss) before tax (after Exceptional items)	61.67	30.31	46.72	130.41	219.81	250.81
4	Net Profit / (Loss) after tax (after Exceptional items)	40.03	15.24	27.93	77.11	145.39	170.66
5	Total Comprehensive (Loss) / Income for the period / year	(4.91)	46.33	28.86	55.91	148.03	165.44
6	Paid-up Equity Share Capital (Face Value of ₹ 2/- each)	8.99	8.99	8.99	8.99	8.99	8.99
7	Other Equity						955.37
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of ₹ 2/- each) (not annualised for quarter and nine months ended)						
	(i) Basic	9.23	3.39	6.42	17.78	32.88	39.03
	(ii) Diluted	9.23	3.39	6.42	17.78	32.87	39.02

### Key numbers of Standalone Unaudited Financial Results

Sr. No.	Particulars	Standalone					
		Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Turnover	237.80	208.02	259.62	668.91	806.08	1,030.61
2	Profit before tax	15.01	10.55	14.25	35.69	57.64	69.71
3	Profit after tax	11.74	7.82	10.80	27.10	43.44	51.05

#### Notes:

- The above is an extract of the detailed format of the quarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and nine months ended December 31, 2024 financial results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com and on the company's website viz. www.gmmpfaudler.com. The same can be accessed by scanning the QR Code provided below.
- Consolidated Results for the quarter ended September 30, 2024 & December 31, 2023, nine months ended December 31, 2023 and year ended March 31, 2024 has been restated on account of completion of final determination of fair values of identified assets and liabilities for the purpose of Purchase Price Allocation of the acquired entities during the Financial year 2022-23 & 2023-24.

For GMM Pfaudler Limited

Sd/-  
 Tarak Patel  
 Managing Director  
 DIN: 00166183

Place: Mumbai  
 Date: February 6, 2025



## Swiggy Limited

(formerly known as Swiggy Private Limited, Bundl Technologies Private Limited)  
 CIN: L74110KA2013PLC096530

Registered office: No. 55, Sy No. 8-14, Ground Floor, I&J Block, Embassy Tech Village, Outer Ring Road, Devarabisanahalli, Bengaluru- 560103, Karnataka, India.  
 Tel: 080-68422422 | Email ID: ir@swiggy.in | Web site: www.swiggy.com

### Statement of unaudited financial results (standalone and consolidated) for the quarter and nine months ended December 31, 2024

The board of directors of the Company, at the meeting held on February 05, 2025, approved the unaudited financial results of the Company for the quarter and nine months ended December 31, 2024 ("Financial Results").

The Financial results along with the Limited Review Report, have been posted on the Company's website at <https://www.swiggy.com/corporate/investor-relations/financial-results> and can be accessed by scanning the QR code.



For and on behalf of the Board of Directors

Swiggy Limited  
 (formerly known as Swiggy Private Limited, Bundl Technologies Private Limited)

Sd/-  
 Sriharsha Majety  
 Managing Director &  
 Group Chief Executive Officer  
 DIN: 06680073

Location: Bengaluru  
 Date: February 05, 2025

Note: The above intimation is in accordance with Regulation 33 read with regulation 47 (1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.



# GOODLUCK INDIA LIMITED

(Manufacturer & Exporter of Engineered Precision Products Since 1987)

E-mail: goodluck@goodluckindia.com | Website: www.goodluckindia.com

Where Precision Meets Perfection



Goodluck India Ltd, a pioneer precision engineering company, having expertise in manufacturing & crafting complex engineering structures, Precision/Auto Tubes and forgings for the Defence, Aerospace, Oil & Gas, Auto and Infra sectors

### Extract of Consolidated Unaudited Financial Results for the Quarter/Period ended on 31<sup>st</sup> December, 2024



Sr. No.	Particular	Consolidated (in Lakhs)			
		Quarter Ended		Nine Month Ended	
		31/12/2024 (Unaudited)	31/12/2023 (Unaudited)	31/12/2024 (Unaudited)	31/12/2023 (Unaudited)
1	Total income from operations	94197.99	87827.15	283126.85	262228.49
2	Net Profit / (Loss) for the period before tax	5381.66	4607.32	16378.22	13215.97
3	Total Comprehensive Income after tax	4118.99	3176.74	12372.98	9505.20
4	Equity Share Capital	654.77	567.13	654.77	567.13
5	Earnings Per Share (in Rs.)	12.12	11.38	37.45	34.60

The full format of the Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com, www.bseindia.com) and on Company's website (www.goodluckindia.com).

Regd. Of: 509, Arunachal Building, Barakhamba Road, Connaught Place, New Delhi - 110001.

Place: Ghaziabad  
 Date: 06.02.2025



For Goodluck India Limited  
 Sd/-  
 M C Garg  
 Chairman  
 DIN: 00292437  
 CIN: L74899DL1986PLC050910

A STAR ALLIANCE MEMBER

## STEP INTO A DREAM IN WESTERN AUSTRALIA



PERTH CITY | BOORLOO

### Think Perth, Think Singapore Airlines.

Welcome to Western Australia's modern capital city nestled in nature, with spectacular landscapes, captivating wildlife, friendly locals and adventures for everyone. Enjoy seamless connections to Perth with Singapore Airlines.

All-in return fares

Economy Class  
 FROM ₹ 53,900\*

Business Class  
 FROM ₹ 181,800\*

Book now at [singaporeair.com](http://singaporeair.com)

WESTERN AUSTRALIA  
 WALKING ON A DREAM



\*Fares shown are per person flying with Singapore Airlines from Ahmedabad to Perth and include all associated taxes and surcharges, as on 14 January 2025. Promotion is valid until 10 February 2025 for travel from 1 March to 30 September 2025. Actual fares may vary between cities in India. Seats based on advertised fares are limited and are subject to availability. Book online at [singaporeair.com](http://singaporeair.com) or contact your travel agent, Singapore Airlines Contact Centre at 1800 121 212. Other conditions apply.

